



શિશુ પરામર્શન કેન્દ્ર દ્વારા માતાનું પ્રશિક્ષણ અને બાળકનો સર્વાંગી વિકાસ થશે

તેજસ્વિતા + ગ્રહણશીલતા + સર્જનશીલતા + સંસ્કારિતા

જન્મથી ત્રણ વર્ષ સુધીનાં શિશુઓની માતાઓને બાળઉછેર સંદર્ભે માર્ગદર્શન આપતું કેન્દ્ર એટલે

## શિશુ પરામર્શન કેન્દ્ર

ત્યાર બાદ

ત્રણથી પાંચ વર્ષનાં બાળકોના ઘડતર માટે ક્રિયા અને અનુભવ આધારિત શિક્ષણ આપતું ઉપવન એટલે

## શિશુનિકેતન

The real pre-school



બાલવંદના એટલે ગોપાલવંદના.



બાળક એક સુગંધિત નાજુક કળી છે,  
એ ખૂલે અને ખીલે એમાં જ એના  
અસ્તિત્વની સુવાસ છે.



હર્ષદ પ્ર. શાહ  
કુલપતિશ્રી,  
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર



શું તમે તમારા બાળકનો સર્વોત્તમ વિકાસ કરવા ઇચ્છો છો ? તો આજે જ શિશુ પરામર્શન કેન્દ્રની મુલાકાત લો.

## ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

( સ્કૂલ ઓફ ચાઇલ્ડ યૂથ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટ )  
સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, ૭-૫ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સર્કલ નજીક  
સેક્ટર- ૨૦, ગાંધીનગર - ૩૮૨૦૨૧  
Email : cu.tapovan@gmail.com | Website : www.cugujarat.ac.in




પ્રત્યેક બાળક મહત્વનું છે.

જન્મથી ત્રણ વર્ષ સુધીનાં શિશુઓની માતાઓને  
બાળઉછેર અંગે માર્ગદર્શન આપતું કેન્દ્ર

## શિશુ પરામર્શન કેન્દ્ર

બાળવિકાસના પ્રથમ પગથિયેથી જ ઉત્તમ મનુષ્યના નિર્માણની પ્રક્રિયા



## ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

### ગાંધીનગર

તેજસ્વી બાળક : તેજસ્વી ભારત

## શિશુ પરામર્શન કેન્દ્ર વિશે

બાળક મુખ્યત્વે અનુકરણ દ્વારા શીખે છે. એ પોતાની આસપાસની વ્યક્તિઓના વર્તન - વ્યવહારનું ખૂબ જ ઝીણવટભર્યું અવલોકન કરે છે. પરિવારજનો જેવું બોલે છે, જેવું કરે છે તેવું જ બાળક બોલે છે અને કરે છે. માતા-પિતા અને પરિવારજનો ઉતમ સંતાનપ્રાપ્તિની ખેવના ધરાવતાં હોય તો તે માટે સૌપ્રથમ પરિવારજનોએ સજ્જ થવું પડે. પ્રત્યેક શિશુ માટે પરિવારજનો સ્વયં આદર્શરૂપ બને, ખાસ કરીને માતા-પિતા. શ્રેષ્ઠ બાળકની પ્રાપ્તિ માટે માતા-પિતાનું જીવન, તેમની લાગણીઓ અને તેમનાં વર્તન-વ્યવહાર પણ યોગ્ય હોવાં જોઈએ. માતા જેટલી પોતાના બાળકમાં ઓતપ્રોત રહેશે, એને જેટલો વધુ પ્રેમ અને સમય આપશે એટલું બાળક વધુ સંવેદનશીલ, બુદ્ધિશાળી અને શારીરિક અને માનસિક દૃષ્ટિએ મજબૂત બનશે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંતર્ગત ચાલતાં તપોવન કેન્દ્રો થકી ગર્ભાધાન પૂર્વેથી, ગર્ભાધાન દરમ્યાન અને બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી માતા પોતાના શિશુમાં ઓતપ્રોત બને તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શિશુના જન્મ બાદ પણ માતા-પિતા તેમ જ પરિવારજનો શિશુની સંપૂર્ણ કાળજી લઈ શકે, શિશુવિકાસનાં તમામ પાસાંનું માર્ગદર્શન મેળવી શકે, બાળઉછેરને લગતી વિવિધ મૂંઝવણો અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી 'શિશુ પરામર્શન કેન્દ્ર' કાર્યરત છે.

## શિશુ પરામર્શન કેન્દ્ર એટલે...

- જન્મથી ત્રણ વર્ષ સુધીનાં શિશુઓની માતાઓને બાળઉછેર સંદર્ભે માર્ગદર્શન આપતું કેન્દ્ર
- બાળવિકાસના તબક્કા અનુસાર બાળકની જરૂરિયાતો સંદર્ભે માર્ગદર્શન આપતું કેન્દ્ર
- શિશુના શારીરિક, માનસિક, પ્રાણિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ અંગેનું માર્ગદર્શન કેન્દ્ર
- શિશુના ત્રણ વર્ષ સુધીના સંસ્કારો અંગે માર્ગદર્શન અને સમજણ આપતું કેન્દ્ર
- શિશુના યોગ્ય ઉછેર સંબંધી માર્ગદર્શન આપતું કેન્દ્ર
- પરિવારના સ્વસ્થ વાતાવરણ તેમ જ ભાવાવરણ સંબંધી માર્ગદર્શન આપતું કેન્દ્ર
- શિશુ- વિકાસને લગતા ઉત્તમ સાહિત્ય અંગેનું માર્ગદર્શન કેન્દ્ર અને પ્રાપ્તિસ્થાન



## શિશુ પરામર્શન કેન્દ્રની વિશેષતાઓ...

- બાળગીત 
  - અભિનય ગીત 
  - હાલરડાં 
  - પ્રભાતિયાં 
  - ભજન 
  - ધૂન 
  - શ્લોક, મંત્ર 
  - બાળવાર્તા 
  - રમત 
  - ઉદ્યોગ 
  - યોગ 
  - સંગીત 
- બાળકના માસ મુજબ ક્રિયાકલાપ  
બાળકોના વિવિધ સંસ્કાર અંગે માર્ગદર્શન

